https://archive.org/details/bk1382/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar

tidar.com

Full Library on https://realpatidar.com/library

ફોન : (૦૨૮૩૨) ૨૭૬૩૪૫

અખિલ ભારતીય લક્ષ્મી નારાયણ સનાતન સમાજ

કેન્દ્ર સ્થાન : શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, શ્રી લક્ષ્મી નારાયણ સંસ્કાર ધામ,
મુ. પો. : દેશલપર, તા. ભુજ (કચ્છ) ૩૭૦ ૦૪૦.

તા. ૦૮/૦૩/૧૦

પ્રતિ,
માનનીય પ્રમુખશ્રી
અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ
પાટીદાર વિદ્યાર્થી ભવન,
નખત્રાણા - કચ્છ.

વિષય :- જ્ઞાતિમાં ચાલતા ધાર્મિક વિવાદને હલ કરવા અંગે.

મહોદયશ્રી,

સાદર જણાવવાનું કે આગામી મે માસમાં કેન્દ્રીય સમાજ તેનો સુવર્ણજયંતી મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનાં સૌ ભાઈ-બહેનો આ ઐતિહાસિક મહોત્સવને એકતાથી અને સંગઠિત થઈને ઉજવે એવી સમાજની ભાવના છે. સમાજની એ ભાવનામાં અમે પણ સુર પૂરાવીએ છીએ પણ એક હાથે તાળી ન પડે. બધા જ તેમા સહકાર આપે તો જ તે સંભવ બને.

સતપંથીઓ દ્વારા સનાતની ભાઈઓ પર કરાયેલા કોર્ટ કેસ પાછા ખેંચી લેવા અને કેન્દ્રીય સમાજની ૧૯મી કલમ મુજબ સામાજિક ધોરણે સમાધાન કરવાની કેન્દ્રીય સમાજ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને આ બાબતને ધ્યાને લઈ કેન્દ્રીય સમાજ એક સમાધાન સમિતિની રચના પણ કરી અને આ દિશામાં પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. અમે સમાધાનની પ્રક્રિયાને આવકારીએ છીએ.

તા. ૨૭-૨-૨૦૧૦ ના કેન્દ્રીય સમાંજના કાર્યાલય નખત્રાણા ખાતે સમાધાન સમિતિની મીટિંગ ચાલી રહી હતી અને આ સમાધાન સમિતિને સતપંથ અને સનાતન બન્ને પક્ષના નિયુક્ત થયેલા સભ્યો સહકાર આપી રહ્યા હતા ત્યારે કેટલાક વિઘ્ન સંતોષીઓ દ્વારા વાતાવરણને દહોળી નાખવાના જે હિનતાભર્યા પ્રયાસો થયા છે એ ખરેખર દુ:ખદ છે.

જે વિઘ્ન સંતોષીઓ સમાજની એકતા અને શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં સહકાર આપવાને બદલે રોડા અટકાવતા હોય તેમને સમાજના સભ્ય કહેવડાવવાનો અધિકાર નથી તેમને સૌએ વખોડી કાઢવા જોઈએ અને સહકાર ન આપવો જોઈએ.

અમે માનીએ છીએ કે સમાજમાં ચાલતાં ધાર્મિક વિવાદોના મૂળમાં કોર્ટ કેસો છે. અમારી કેન્દ્રીય સમાજને આગ્રહભરી વિનંતી છે કે બેંગલોરના રમેશ વાગડિયા અને તેમના વડીલો પર થયેલો કોર્ટ

realpatidar.com

https://archive.org/details/bk1382/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com - Created using: Create-D-File-Step2.pyw (v51)
Created on: 2026-04-11T18:20:02

https://archive.org/details/bk1382/page/n2/mode/1up

Real Patidar
Unravel Truth

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.04.11 18:20:07 +05'30'

realpatidar.com

ફોન : (૦૨૮૩૨) ૨૭૬૩૪૫

અખિલ ભારતીય લક્ષ્મી નારાયણ સનાતન સમાજ

કેન્દ્ર સ્થાન : શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, શ્રી લક્ષ્મી નારાયણ સંસ્કાર ધામ,
મુ. પો. : દેશલપર, તા. ભુજ (કચ્છ) ૩૭૦ ૦૪૦.

તા. ૦૮/૦૩/૧૦

પ્રતિ,
માનનીય પ્રમુખશ્રી
અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ
પાટીદાર વિદ્યાર્થી ભવન,
નખત્રાણા - કચ્છ.

વિષય :- જ્ઞાતિમાં ચાલતા ધાર્મિક વિવાદને હલ કરવા અંગે.

મહોદયશ્રી,

સાદર જણાવવાનું કે આગામી મે માસમાં કેન્દ્રીય સમાજ તેનો સુવર્ણજયંતી મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનાં સૌ ભાઈ-બહેનો આ ઐતિહાસિક મહોત્સવને એકતાથી અને સંગઠિત થઈને ઉજવે એવી સમાજની ભાવના છે. સમાજની એ ભાવનામાં અમે પણ સુર પૂરાવીએ છીએ પણ એક હાથે તાળી ન પડે. બધા જ તેમા સહકાર આપે તો જ તે સંભવ બને.

સતપંથીઓ દ્વારા સનાતની ભાઈઓ પર કરાયેલા કોર્ટ કેસ પાછા ખેંચી લેવા અને કેન્દ્રીય સમાજની ૧૯મી કલમ મુજબ સામાજિક ધોરણે સમાધાન કરવાની કેન્દ્રીય સમાજ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને આ બાબતને ધ્યાને લઈ કેન્દ્રીય સમાજ એક સમાધાન સમિતિની રચના પણ કરી અને આ દિશામાં પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. અમે સમાધાનની પ્રક્રિયાને આવકારીએ છીએ.

તા. ૨૭-૨-૨૦૧૦ ના કેન્દ્રીય સમાજના કાર્યાલય નખત્રાણા ખાતે સમાધાન સમિતિની મીટિંગ ચાલી રહી હતી અને આ સમાધાન સમિતિને સતપંથ અને સનાતન બન્ને પક્ષના નિયુક્ત થયેલા સભ્યો સહકાર આપી રહ્યા હતા ત્યારે કેટલાક વિઘ્ન સંતોષીઓ દ્વારા વાતાવરણને દહોળી નાખવાના જે હિનતાભર્યા પ્રયાસો થયા છે એ ખરેખર દુ:ખદ છે.

જે વિઘ્ન સંતોષીઓ સમાજની એકતા અને શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં સહકાર આપવાને બદલે રોડા અટકાવતા હોય તેમને સમાજના સભ્ય કહેવડાવવાનો અધિકાર નથી તેમને સૌએ વખોડી કાઢવા જોઈએ અને સહકાર ન આપવો જોઈએ.

અમે માનીએ છીએ કે સમાજમાં ચાલતાં ધાર્મિક વિવાદોના મૂળમાં કોર્ટ કેસો છે. અમારી કેન્દ્રીય સમાજને આગ્રહભરી વિનંતી છે કે બેંગલોરના રમેશ વાગડિયા અને તેમના વડીલો પર થયેલો કોર્ટ

realpatidar.com

https://archive.org/details/bk1382/page/n3/mode/1up

realpatidar.com

ફોન : (૦૨૮૩૨) ૨૭૬૩૪૫

અખિલ ભારતીય લક્ષ્મી નારાયણ સનાતન સમાજ

કેન્દ્ર સ્થાન : શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, શ્રી લક્ષ્મી નારાયણ સંસ્કાર ધામ,
મુ. પો. : દેશલપર, તા. ભુજ (કચ્છ) ૩૭૦ ૦૪૦.

કેસ પાછો ખેંચાવો જોઈએ અને સાથે બેસીને સમાધાન થવું જોઈએ. એ જ રીતે મોડાસાના ઉમિયા માતાજી મંદિરની મડાગાંઠ પણ ઉકેલાવી જોઈએ. તેમજ અન્ય કોઈ આવા નાના મોટા કોર્ટ કેસો હોય તે પણ પાછા ખેંચાવા જોઈએ અને સમાજની ૧૯મી કલમ મુજબ સમાધાન થવું જોઈએ અને ભવિષ્યમાં આવા કેસો ન થાય એ માટે ન્યાય સમિતિને સાથે રાખીને એક સમિતિનું ગઠન કરવું જોઈએ.

સમાજની આ સમાધાનની પ્રક્રિયાનો જે કોઈ વિરોધ કરતો હોય કે અડચણો ઉભી કરતાં હોય તેની સાથે સમાજે કડક હાથે કામ લેવું જોઈએ. જો સમાજ હવે ઢીલી નીતિ રાખશે તો સમાજની એકતા જોખમાશે એટલે સમાજને સહકાર ન આપનાર તત્વોને ખૂલ્લાં પાડવા જોઈએ અને તેમને કડકમાં કડક નસિયત થવી જોઈએ જેથી આવા અસામાજિક કૃત્ય કરનાર અન્ય લોકોને પણ બોધપાઠ મળે.

આ સંસ્થા કેન્દ્રીય સમાજના તમામ કાર્યોમાં સંપૂર્ણપણે સાથ અને સહકાર આપશે તેની અમે અત્રેથી ખાતરી આપીએ છીએ. આશા રાખીએ કે સમાજ ઉપરોકત બાબતે ત્વરીત કાર્યવાહી કરી સમાજમાં ચાલતા આ ધાર્મિક વિવાદોને હલ કરવા પ્રયાસો કરશે.

જે. એલ. ચોપડા

જેઠાભાઈ લાલજી ચોપડા
પ્રમુખ
અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ

realpatidar.com